

16 મે 2018

ડાઉનટાઉન બ્રેમ્પટન રોમાંચક મેકઓવર હાથ ધરવા આગળ વધી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – ડાઉનટાઉન બ્રામ્પટનમાં રોમાંચક પરિવર્તન આવી રહ્યું છે! બ્રેમ્પટન સીટી કાઉન્સિલે આજે સર્વસંમતિથી ડાઉનટાઉન રિઈમેજિન્ડ પહેલ માટે ભલામણ કરવામાં આવેલા પ્રોજેક્ટ પ્લાન્સ આગળ ધપાવવાની મંજૂરી આપી. આ પ્રોજેક્ટ જેમાં અતિમહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અને શહેરના મધ્યમાં નોંધપાત્ર સ્ટ્રીટસ્કેપિંગનો સમાવેશ થાય છે તેનો અમલ રિજન ઓફ પીલ દ્વારા સીટી ઓફ બ્રેમ્પટન સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

- હાલમાં છે તે જીર્ણ થતી જતી ગટરની લાઈન બદલવી અને પુનઃરેખાંકિત કરવી;
- પાણીની મેઈન લાઈન અને સેનિટરી અને સ્ટોર્મ ગટરો અને અન્ય યુટિલિટીના કામો કરવા જેથી ભવિષ્યની વૃદ્ધિને સમાવી શકાય; અને,
- નવા સ્ટ્રીટસ્કેપિંગનું બાંધકામ.

સુનિશ્ચિત કરવું કે તે સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય, વાહનની યાતાયાત બાંધકામ દરમિયાન મર્યાદિત હશે જેને પૂર્ણ થતા 2.5 થી 3 વર્ષ લાગે એવી અપેક્ષા રાખવામાં આવે છે. રિજન ઓફ પીલ અતિમહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ 2018ના પાનખરમાં પ્રારંભ કરશે. સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવાની લક્ષ્યાંકિત તારીખ 2021 છે.

પૂર્ણ થશે ત્યારે ડાઉનટાઉન રિઈમેજિન્ડ ઐતિહાસિક ફોર કોર્નર્સની આસપાસ રસલક્ષી સુંદર સ્ટ્રીટસ્કેપ સાથેના એક ગતિશીલ જાહેર ક્ષેત્રનું સર્જન કરશે. નવો સ્ટ્રીટસ્કેપ - મિલ સ્ટ્રીટ સાઉથ થી કિવન સ્ટ્રીટ ખાતેના ચેપલ સ્ટ્રીટ સુધી અને નેલ્સન સ્ટ્રીટ વેસ્ટથી મેઈન સ્ટ્રીટ ખાતેના વિલિંગટન સ્ટ્રીટ સુધી - વટેમાર્ગુઓ, સાયકલિસ્ટ્સ અને મોટરિસ્ટ્સનું વહન સુરક્ષિત રીતે અને નિરંતરપણે કરશે. ઉચ્ચ રચના ધરાવતી સુવિધાઓની શ્રેણી સાથે જેમકે સાયકલના માર્ગો ઉમેરવાથી શેરીઓ અને ફુટપાથ વચ્ચેના લેન્ડસ્કેપિંગ સુધી જેથી વટેમાર્ગુઓની ચાલી શકવાની ક્ષમતા અને સુવિધાઓ વધારી શકાય, ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ખરેખર રોમાંચક પરિવર્તન હાથ ધરવામાં આવી રહ્યું છે.

વિડિયોઝ, ચિત્રો, અને અપડેટ્સ સહિત વધુ માહિતી માટે નિવાસીઓ અને ધંધાદારીઓને અહીં સાઈન અપ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે www.brampton.ca/downtownreimagined

શાની અપેક્ષા રાખવી.

- વટેમાર્ગુઓ માટે અને ધંધાદારીઓ આખા ડાઉનટાઉન કોરમાં તમામ સમયે પહોંચી શકશે.

- વાહનોની યાતાયાત માટે 2 વર્ષ સુધી માર્ગ બંધ રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે જે ક્વિન્સ સ્ટ્રીટ પર જિયોર્જ સ્ટ્રીટ અને ચેપલ સ્ટ્રીટ વચ્ચે હશે (ચાર રસ્તાઓ ચાલુ રહેશે) અને મેઈન સ્ટ્રીટ પર વેલિંગ્ટન સ્ટ્રીટ અને નેક્સન સ્ટ્રીટ વેસ્ટ વચ્ચે હશે (ચાર રસ્તાઓ ચાલુ રહેશે).
- સીટી શક્ય એટલા પ્રયાસ કરી રહ્યા છે કે ગાર્ડન સ્કવેર અથવા કેન વિલ્હાન્સ સ્કવેરમાં થતા તહેવારો અને પ્રસંગોને જાળવી શકાય.
- યાતાયાતમાં થનાર કોઈ પણ બદલાવ પહેલા માર્ગ ઉપર સૂચના ફ્લકો અને માર્ગ શોધવા માટેના પાટિયા વધારાશે જેથી જાહેર જનતાને તેમનો રૂટ નક્કી કરવા માટે પર્યાપ્ત સૂચના મળે. બાંધકામ દરમિયાન "કામકાજ ચાલુ છે"ની નિશાનીઓનો સમાવેશ કરવામાં આવશે.
- બાંધકામના સમયગાળા દરમિયાન પાર્કિંગ ગેરેજના લાભ આપવામાં આવશે.
- સુધારેલા માર્ગ શોધવાના સૂચનોની મદદથી મુલાકાતીઓને હાલમાં છે તેવા પાંચ પાર્કિંગ ગેરેજ સુધી દિશાસૂચન આપવામાં આવશે.

ક્વોટ:

"સીટી ઓફ બ્રમ્પટનના લોકોએ જાણાવી દીધું છે. તેઓને જોઈએ છે એક વધુ ગતિશીલ શહેર જે રહેવા માટે કામ કરવા અને રમવા માટે રોમાંચક હોય. આપનું ડાઉનટાઉન પરિવર્તનના આરે છે – આપણે ત્યાં યુનિવર્સિટી આવી રહી છે, નવું સેંટર ફોર ઈનોવેશન બની રહ્યું છે અને આ પ્રોજેક્ટ તો દરેક રોમાંચિત કરનારી બાબતો માટે જોરદાર પ્રારંભ છે."

- *કાઉન્સિલર ડુગ વિલ્હાન્સ, અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ કમિટી (Councillor Doug Whillans, Chair, Public Works and Engineering Committee)*

"ડાઉનટાઉન રિઈમેજિન્ડ પ્રથમ સોપાનો પૈકી એક છે જે બ્રમ્પટન 2040 વિઝનને આવકારશે. આગામી પાંચ વર્ષમાં ડાઉનટાઉન બ્રમ્પટન પ્રવૃત્તિઓથી ગુંજશે કારણકે વૃદ્ધિ અને વિકાસ લાવતી સંખ્યાબંધ પહેલો આવશે. અમે માનીએ છીએ કે બાંધકામથી ખૂબ પ્રભાવિત થવાશે અને અમે અમે અમારા રિજન ઓફ પીલ ખાતેના ભાગીદારો, ડાઉનટાઉન BIA અને અમારા તમામ હિસ્સેદારો સાથે કાર્ય કરવા પ્રતિબદ્ધ છીએ જેથી વિક્ષેપ ઓછામાં ઓછો થાય અને યાતાયાત અને વટેમાર્ગુઓની હિલચાલ બાંધકામ દરમિયાન સુરક્ષિત રીતે પાર પડે.

- *હૅરી શ્લેન્જ, મુખ્ય વહીવટકર્તા (Harry Schlange, Chief Administrative Officer)*

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી

રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.